

ત્રણ માસ અગાઉના વણશોધાયેલ મર્ડરના ગુનાના આરોપીને શોધી કાઢતી,

લીંબાયત પોલીસ, સુરત શહેર

સુરત શહેરના લીંબાયત પો.સ્ટે. વિસ્તારમાં વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા લીંબાયત પો.સ્ટે.ના પોલીસ માણસોની અલગ અલગ ટીમ બનાવી પો.સ.ઇ.શ્રી એમ.જી.રાહોડ તથા સ્ટાફના પોલીસ માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે વખતે નીલગીરી સર્કલ ખાતે આવતા પો.સ.ઇ. શ્રી એમ.જી. રાહોડ તથા અ.હે.કો.વિનોદ ભાઇદાસ તેમજ અ.પો.કો. જીજ્ઞેશ અંબાલાલનાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, લીંબાયત પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૨૧૯/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૦૨ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબનો ગુનો તા.૦૭/૦૭/૨૦૧૯ ના રોજ દાખલ થયેલ હોય જે ગુનાનો આરોપી આજદિન સુધી નાસતો ફરતો હોય, જે હાલમાં ગોડાદરા આવાસ સુમનશ્રુતિ એપાર્ટમેન્ટના ગેટ પાસે ઉભેલ હોય અને જેને પીળા કલરનો પ્રીન્ટેડ ડીઝાઇનવાળો શર્ટ પહેરેલ હોય જેનું નામ નરેશ વેંકટયા વંગા હોય વિગેરે મતલબની બાતમી મળતાં બીજા પોલીસ માણસોને તાત્કાલિક નીલગીરી સર્કલ ખાતે બોલાવી તમામને બાતમી હકિકતથી વાકેફ કરી બાતમી હકિકતવાળી જગ્યાએ જતાં ત્યાં બાતમી હકિકતમાં જણાવેલ વર્ણનવાળો ઇસમ હાજર હોય જે ઇસમને સાથેના પોલીસ માણસો મારફતે કોર્ડન કરી ત્યાંજ પકડી પાડી તે ઇસમને પોતાનું નામ સરનામું પુછતાં તેણે પોતાનું નામ નરેશ વેંકટયા વંગા ઉં.વ.૩૨ ધંધો.મજૂરી રહે.મકાન નં.૮૦૭, બિલ્ડીંગ નં-એ, સુમનશ્રુતિ આવાસ ગોડાદરા લીંબાયત, સુરત મુળ રહે.ગામ.નાગરમ તા.થાના. ખેસ્મુદ્રમ જી.વારંગલ તેલંગાણાનો હોવાનું જણાવેલ જેઓને ઉપરોક્ત ગુના સબંધે પુછપરછ કરતાં જણાવેલ કે, તા.૦૬/૦૭/૨૦૧૯ ના રોજ રાત્રીના આશરે સાડા નવેક વાગ્યાના સમયે નોકરી પરથી ઘરે જતો તે વખતે એક ટેમ્પો ચાલકે આરોપીની નજીકથી ટેમ્પો કટ મારીને લેતાં તેને બુમ મારી ઉભો રહેવા કહેતાં તે ઉભો રહેલ અને આરોપી પાસે આવી ગાળા ગાળી કરવા લાગેલ અને એક આપટ મારેલ અને તેણે કહેલ કે, તું અહીંજ ઉભો રહેજે હું હાલ જ ટેમ્પો મુકીને આવું છું તેમ કહી થોડી વારમાં પરત આવી આરોપી સાથે ઝગડો કરવા લાગેલ જેથી આરોપીએ ગુસ્સામાં આવી પાસેના કટર વડે તેને છાતીની નીચે જમણી બાજુ બે ઘા મારી દિધેલ જેથી તેને લોહી આવવા લાગતાં ત્યાંથી ઘરે ભાગી ગયેલ વિગેરે જે ઉપરોક્ત ગુન્હો વણશોધાયેલ હોય જે શોધી કાઢી, પ્રસંશનીય કામગીરી કરવામાં આવેલ છે.